



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩

કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦



તા.૧૧/૦૯/૨૦૧૮ મંગળવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૭૬૬/૧૮

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૨૪ કેસ કરી, ૨૫ વ્યક્તિઓને ઝડપી, ૧૦૮ લીટર દેશી દારૂ, ૧૫૯ બોટલ ઈંગ્લીશ દારૂ, ૩૬૦ બિયર ટીન, ૨ કાર અને ૧ મોટર સાયકલ કબજે કર્યું હતું. તેમજ જુગાર ધારા હેઠળ ૨ કેસ કરી ૫ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૧૯,૯૭૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૭૬૭/૧૮

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૬૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી તેમજ પ્રોહી ૯૩ મુજબ ૧ વ્યક્તિની અને પાસા હેઠળ ૬ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

લુંટ :-

સમાચાર યાદી નં.૧૭૬૮/૧૮

નરોડા: ઉદયસિંગ જયરામસિંગ રાહોડ (રહે.શ્રીનાથ એસ્ટેટ નંબર-૭૪/૭૫, રણાસણ રેલ્વે કોસિંગ પાસે નરોડા જીઆઈડીસી નરોડા) એ નરોડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૦/૦૯/૧૮ કલાક ૧/૩૦ વાગ્યાના સુમારે સુતરના કારખાના દિલખુશ મટનની દુકાન સામે એક મોટર સાયકલ ઉપર આવેલ ચાર અજાણ્યા પુરૂષોએ ઉદયસિંગ અને તેમના બનેવી રાહુલ મુનિમસિંગને માર મારી, તેમના સ્ટેટ બેંકના બે એટીએમ કાર્ડ, રોકડ રૂપિયા ૫,૦૦૦/- તથા ઉદયસિંગની એક્ટીવા નંબર જીજે.૧૮.એન.સી.૦૫૮૭ કિમત રૂપિયા ૨૫,૦૦૦/- લુંટ કરી નાસી ગયા હતા. આ ગુનાની તપાસ પોસઇશ્રી એન.કે.ડાભી ચલાવે છે.

ચોરી :-

સમાચાર યાદી નં.૧૭૬૯/૧૮

શહેરકોટડા: મહેન્દ્રભાઈ ખીમજીભાઈ પરમાર (રહે,રામપ્રસાદની ચાલી અનીલ સ્ટાર્ચ મીલની પાછળ બાપુનગર) એ તા.૧૦/૯/૧૮ નારોજ શહેરકોટડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૫/૯/૧૮ કલાક ૪/૦૦ વાગ્યાના સુમારે બાપુનગર ચીરાગ ડાયમંડ એસ્ટેટની બાજુમાં આવેલ ખેતલાઆપા ટી સ્ટોલના અંદરના રૂમમાં ટેબલ ઉપરથી અજાણી વ્યક્તિ સોની કંપનીનો "SLT-A58" મોડલનો કેમેરો કિમત રૂપિયા ૬૦,૦૦૦/- ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી પી.વી.ઘોકડીયા ચલાવે છે.

વાહન ચોરી :-

સમાચાર યાદી નં.૧૭૭૦/૧૮

રામોલ: અનારજી વેલાજી ઠાકોર (રહે,સ્વયંભુ હોસ્પીટલ વસ્ત્રાલ રીંગ રોડ) એ તા.૩૧/૦૮/૧૮ સાજના ૬/૦૦ વાગે વસ્ત્રાલ રીંગ રોડ સ્વયંભુ હોસ્પીટલની આગળ કંમ્પાઉન્ડમાં પોતાની મહીન્દ્રા કંપનીની બોલેરો જીપ નંબર જીજે-૦૬-ઇ.એચ-૩૦૪૨ કિમત રૂપિયા ૧,૫૦,૦૦૦/- પાર્ક કરી હતી. જેની ચોરી તા.૧/૯/૧૮ કલાક ૩/૧૫ વાગ્યા દરમ્યાન થઈ હતી. આ અંગેની ફરીયાદ અનારજી ઠાકોરે તા.૧૦/૯/૧૮ નારોજ રામોલ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.વી.બી.વાઘેલા ચલાવે છે.

ત્રીજા માળે ફ્લેટની બારીમાંથી પડી જતાં મૃત્યુ :-

સમાચાર યાદી નં.૧૭૭૧/૧૮

નરોડા: નરોડા હરીદર્શન ચાર રસ્તા નજીક દેવકૃપા ફ્લેટ ત્રીજો માળ ખાતે રહેતા કુંજલભાઈ પટેલનો પુત્ર આરવ કુંજલભાઈ પટેલ (ઉ.વ.૦૪) તા.૧૦/૯/૧૮ સાજના ૪/૧૫ વાગ્યાના સુમારે રહેણાંકના ફ્લેટના બેડરૂમની બારીમાંથી નીચે પડી જતા, માથામા ગંભીર ઇજા થતા સારવાર માટે તેને સેલ્બી હોસ્પીટલમાં લઈ જતા ફરજ પરના ડૉ.શ્રીએ તેને મૃત જાહેર કર્યો હતો. આ અંગે નરોડા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી રમેશભાઈ અમૃતભાઈ ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૧૭૭૨/૧૮

શહેરકોટડા: નટવરભાઈ છગનભાઈ પટેલ (ઉ.વ.૬૦)(રહે.બાઇજીની ચાલી, વોરાના રોજા પાસે સરસપુર) એ અગમ્ય કારણસર તા.૮/૯/૧૮ કલાક ૮/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે પોતાની જાતે પોતાના શરીર ઉપર કેરોસીન છાંટી સળગી ગયા હતા. સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તા.૧૦/૯/૧૮ સાજના ૪/૩૦ વાગે તેમનું મૃત્યુ નિપજયું હતું. આ અંગે શહેરકોટડા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી ઇશ્વરભાઈ સોમાભાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.